

તેઓએ નીચેની શરતોએ હસરતને ભાગીદાર તરીકે દાખલ કર્યો.

- (૧) મકાન અને સ્કુટરની કિંમત અનુક્રમે રૂ. ૪૫૦૦૦ અને રૂ. ૬૫૦૦ ગણાવી.
- (૨) સ્ટોકની કિંમત ૧૦% ઘટાડવી અને દેવાદારો પર ૫% લેખે ઘાલખાધ અનામત રાખવી.
- (૩) લેણદારોમાં સમાયેલ રૂ. ૨૦૦૦નું એક દેવું હવે ચુકવવું પડે તેમ નથી.
- (૪) હસરત મૂડી તરીકે રૂ. ૪૦૦૦૦ લાવે છે.
- (૫) પાઘડી ખાતું રૂ. ૨૦૦૦૦ થી ઉભું કરવાનું છે અને તે હસરતના પ્રવેશ પછી માંડી વાળવાનું છે.
- (૬) નફાની વહેંચણીનું નવું પ્રમાણ ૨ : ૧ : ૧ નક્કી થયું.

ઉપરોક્ત માહિતી પરથી નફા-નુકશાન હવાલાખાતું, રોકડખાતું, ભાગીદારોનાં મૂડીખાતાં અને નવી પેઢીનું પાકું સરવૈયું બનાવો. પાઘડી અને જરૂરી આમનોંધ પણ આપો.

પ્ર.૨

- (અ) ટૂંકનોંધ લખો : નિવૃત્ત થતા ભાગીદારોને ચુકવવાની રકમ. (૦૫)
  - (બ) અ, બ અને ક ભાગીદારો છે. બ નિવૃત્ત થાય છે ચોપડે પાખડી રૂ. ૨૦૦૦૦ દર્શાવેલું છે. પરંતુ તેનું પુનઃ મૂલ્ય રૂ. ૮૦૦૦૦ કર્યું. બ ની નિવૃત્તિ વખતે પાઘડી નિવૃત્ત ભાગીદારના ભાગ જેટલી જ ચોપડે લાવવાની છે અને બાકીની રકમની પાઘડી નવી પેઢીમાં લખી વાળવાની છે. (૦૫)
- જરૂરી આમનોંધ લખો.
- (ક) X, Y અને Z એક પેઢીમાં ભાગીદારો છે. X નિવૃત્ત થાય છે. Y અને Z એ X નો ભાગ ૫:૩ના પ્રમાણમાં વહેંચવા સંમત થાય છે. નફાનુકશાનનું નવું પ્રમાણ શોધો. (૦૫)

**અથવા**

- પ્ર.૨ A, B અને C સરખે હિસ્સે નફો નુકશાન વહેંચતા ભાગીદારો છે. તા. ૩૧-૩-૨૦૧૬ના રોજનું પાકું- સરવૈયું નીચે પ્રમાણે છે. (૧૫)

**પાકું સરવૈયું**

જવાબદારી	રૂ.	મિલકતો	રૂ.
<b>મૂડી ખાતા:</b>		<b>પાઘડી</b>	<b>૧૪૪૦૦</b>
A ૮૦૦૦૦		જમીન-મકાન	૮૦૦૦૦
B ૪૮૦૦૦		રોકાણ (પડતર કિંમત)	૧૬૦૦૦
C ૭૨૦૦૦	૨૦૦૦૦૦		
સામાન્ય અનામત	૧૪૪૦૦	ફર્નિચર	૩૬૦૦૦
લેણદારો	૪૧૬૦૦	સ્ટોક	૨૬૨૪૦
રોકાણ વધઘટ ભંડોળ	૧૪૪૦	દેવાદારો	૫૧૨૦૦
		— ધા. અનામત	૧૬૦૦
		રોકડસિલક	૧૬૦૦૦
		નફાનુકશાન ખાતું	૧૮૨૦૦
	<b>૨૫૭૪૪૦</b>		<b>૨૫૭૪૪૦</b>

ઉપરોક્ત પાકા સરવૈયાની તારીખે, નીચેની શરતો એ C પેઢીમાંથી નિવૃત્ત થયો.

- (૧) પેઢીની પાઘડીનું મૂલ્ય રૂ. ૨૪૦૦૦ નક્કી થયું.
- (૨) જમીન-મકાનની કિંમત રૂ. ૮૮૦૦૦ ગણવાની છે.
- (૩) રોકાણ વધઘટ ભંડોળ રૂ. ૯૬૦ રાખવાનું છે.
- (૪) દેવાદારો પર હવે ઘાલખાધ અનામત રાખવાની કોઈ જરૂર નથી.
- (૫) સ્ટોકની કિંમતમાં ૨૫% ઘટોડો કરવાનો છે.
- (૬) લેણદારો પર ૪% લેખે વટાવ અનામતની જોગવાઈ કરવાની છે.